



પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી
જી.આઇ.ડી.સી વટવા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર
ફોનનં-૦૭૯-૨૫૮૩૦૦૦૪
polstn-vatvagidc-ahd@gujarat.gov.in



પોલીસ કટ્રોલ રૂમ ટેલીફોન નંબર-૦૭૯-૨૫૬૨૭૫૧૦

પ્રેસનોટ

૨૪ કલાકમાં મોબાઇલ સ્નેચીંગનો ગુનો શોધતી જીઆઈડીસી વટવા

પોલીસ

મે.પોલીસ કમિશ્નર સાહેબ અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૨ સાહેબ નાઓ તરફથી અમદાવાદ શહેરમાં હાલમાં વધતા જતાં મોબાઇલ સ્નેચીંગના બનાવ અટકાવવા તેમજ મોબાઇલ સ્નેચીંગના ભેદ ઉકેલવા મળેલ સુચના અનુસંધાને તેમજ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર 'જે' ડીવીઝન સાહેબ નાઓના માર્ગદર્શન તળે જીઆઈડીસી વટવા પો.સ્ટે અધિકારી/કર્મચારી કાર્યરત છે જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.આર.ગોહિલ જીઆઈડીસી વટવા પો.સ્ટે નાઓના માર્ગદર્શન મુજબ તા:૧૫/૦૭/૨૦૧૯ ના રોજ દાખલ થયેલ મોબાઇલ સ્નેચીંગના ગુનાની તપાસ દરમ્યાન સર્વેલન્સ પોસઈ સી.એમ.રાઠોડ નાઓ સ્ટાફના મ.સ.ઈ મહેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ તથા અહેકો બળવંતસિંહ મંગળસિંહ બ.નં ૯૩૧૬ તથા અપોકો ફીરોજશા મરદાનશા બ.નં ૯૦૦૧ તથા અપોકો જ્યંતિભાઈ નાગરભાઈ બ.નં ૬૧૬૯ તથા અપોકો બળદેવસિંહ ઘનશ્યામસિંહ બ.નં ૧૧૮૧૩ તથા એલ.આર દિવ્યરાજસિંહ રવિન્દ્રસિંહ બ.નં ૧૯૦ તથા એલ.આર રવિકુમાર શાહુભાઈ બ.નં ૪૨૬૫ તથા એલ.આર હરદીપસિંહ ભુપતસિંહ બ.નં ૪૮૫ તથા એલ.આર સચિન અનિલભાઈ બ.નં ૧૨૭૨૨ સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જીઆઈડીસી વટવા પો.સ્ટે ફ.ગુ.ર.નં ૨૧/૧૯ ધી ઈપીકો કલમ ૩૭૯(એ)૧, ૩૭૯(એ)૩, ૩૭૯(એ)૪, ૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫(૧) મુજબના કામે જીઆઈડીસી વટવા બ્રીજના છેડા પાસે ફરીયાદીનો મોબાઇલ સ્નેચીંગ કરનાર ૧) આસીફ ઉર્ફે મોહસીન ઉર્ફે બછડા સ/ઓ સલીમભાઈ જાતે શેખ ઉ.વ ૨૫ રહે- બ્લોક નં ૪૭/૨૨૮૬ સદભાવનાનગર ચાર માળીયા, વટવા રેલ્વે સ્ટેશન પાસે વટવા અમદાવાદ શહેર (૨) મોહંમદઈમરાન મોહંમદઅખ્તર સૈયદ ઉ.વ ૧૯ રહે- રેનબસેરા, વટવા રેલ્વે બ્રીજના નીચે, વટવા અમદાવાદ શહેર નાઓને સ્નેચીંગ કરેલ વીવો કંપનીના વી-૧૫ મોડલનના મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૧૨,૦૦૦/- તથા મોબાઇલ સ્નેચીંગ વખતે ઉપયોગમાં લીધેલ એક્સેસ ટુ વ્હીલર નં GJ-27-TCA-0042 તથા છરી સાથે તા: ૧૬/૦૭/૧૯ ના ક: ૧૭/૩૦ વાગે પકડી પાડી મોબાઇલ સ્નેચીંગ ગુનાનો ભેદ ઉકેલી કાઢી સારી કામગીરી કરેલ છે.

આરોપી નં (૧) ચોટીલા પો.સ્ટે ફ.ગુ.ર.નં ૨૮/૧૫ ના ગુનામાં પકડાયેલ છે તેમજ વટવા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં-૫૦૬૮/૧૮ તથા ૫૧૦૦/૧૮ તથા સેકન્ડ ગુ.ર.નં-૩૦૧૧/૧૮ ના ગુનામાં પકડાયેલ છે. તેમજ ભુજ જેલ ખાતે પાસા અટકાયત પણ ભોગવેલ છે.

